

# Narayan Kavach In Gujarati

॥राजोवाच॥

यया गुप्तः सहस्राक्षः सवाहान् रिपुसैनिकान्।क्रीडन्निव विनिर्जित्य त्रिलोक्या  
बुभुजे श्रियम्॥१

भगवंस्तन्ममाख्याहि वर्म नारायणात्मकम्।यथाऽस्ततायिनः शत्रून् येन  
गुप्तोऽजयन्मृधे॥२

॥राजोवाच॥

यया गुप्तः सहस्राक्षः सवाहान् रिपुसैनिकान्। क्रीडन्निव विनिर्जित्य त्रिलोक्या  
बुभुजे श्रियम्॥१॥

ભગવંસ્તન્મમાખ્યાહિ વર્મ નારાયણાત્મકમ્। યથાસ્તતાયિનઃ શત્રૂન્ યેન  
ગુપ્તોઽજયન્મૃધે॥2॥

પરીક્ષિત રાજાએ કહ્યું : હે મહારાજ - વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્ર દેવે રમત માત્રમાં  
સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રેલોક્યનું રાજ્ય  
ભોગવ્યું તે ' નારાયણ કવચ ' રૂપ વિદ્યા મને કહો. સાથે એ પણ બતાવો કે તેને  
તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુઓ ઉપર વિજય  
મેળવ્યો. (1)(2)

**Oh God please share with me that armour of Narayana,By  
which the thousand eyed Indra was able to drive  
away,The well armed soldiers of his enemy as if it is a  
play,And gain control of the three worlds and wealth,And  
also was safe in the battle field and became victorious.**

॥श्रीशुक उवाच॥

वृतः पुरोहितोस्त्वाष्ट्रो महेन्द्रायानुपृच्छते।नारायणाख्यं वर्माह तदिहैकमनाः शृणु॥३

॥श्रीशुक उवाच॥

વૃતઃ પુરોહિતોસ્ત્વાષ્ટ્રો મહેન્દ્રાયાનુપૃચ્છતે। નારાયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શૃણુ॥  
3॥

શ્રી શુકદેવજીએ કહ્યું : પુરોહિત બનેલા વિશ્વરૂપે પ્રશ્ન પૂછનાર ઇન્દ્ર દેવને જે  
નારાયણ કવચ કહેલું તર હવે એકાગ્ર મનથી સાંભળો.

**(3)Viswaroopa the son of Thwashtra, when he was  
made,The priest Of Indra taught him this armour of  
Narayana,And I will teach you that and please listen to it  
with concentration.**

विश्वरूप उवाचधौताङ्घ्रिपाणिराचम्य सपवित्र उदङ् मुखः।कृतस्वाङ्गकरन्यासो  
मन्त्राभ्यां वाग्यतः शुचिः॥४

नारायणमयं वर्म संनह्येद् भय आगते।पादयोर्जानुनोरूर्वोरूदरे हृद्यथोरसि॥५  
मुखे शिरस्यानुपूर्व्यादौकारादीनि विन्यसेत्।ॐ नमो नारायणायेति विपर्ययमथापि  
वा

विश्वरूप उवाचधौताङ्घ्रिपाणिंराचम्य सपवित्र उदङ् मुखः। कृतस्वाङ्गकरन्यासो  
मन्त्राभ्यां वाग्यतः शुचिः॥४॥

नारायणमयं वर्म संनह्येद् भय आगते। पादयोर्जानुनोर्वाङ्गरे हृद्यथोरसि॥५॥  
मुखे शिरस्यानुपूर्व्यादौकारादीनि विन्यसेत्। ॐ नमो नारायणायेति विपर्ययमथापि  
वा॥६॥

विश्वरूपे कर्तुं : डे देवराज एन्द्र ! भयनो प्रसंग आवी पडे त्यारे नारायण कवच  
धारण करी पोताना शरीरनी रक्षा करी लेवी जेईअे. अनी विधि आ प्रमाणे छे के  
पडेला डाय पग धोई आयमन करवुं.पछी डायमां कुशनी वींटी धारण करी उत्तर  
तरङ्ग मुख राणी बेसी जवुं. पछी कवच धारण पर्यंत बीजुं कांई पण न बोलवानो  
निश्चय करी पवित्रताथी " ॐ नमो नारायणाय " अने " ॐ नमो भगवते वासुदेवाय  
" आ मंत्रो द्वारा हृद्ययादी अंग न्यास तथा अंगूष्ठादिकर न्यास करवा. पडेला " ॐ  
नामो नारायणाय " आ अष्टाक्षर मंत्रना ॐ वगेरे आठ अक्षरोना क्रमशः बे पग, बे  
गोडण,बे साथण,पेट,हृद्य, वक्ष स्थण, मुख अने मस्तकमां न्यास करवा अथवा  
पूर्वोक्त मंत्रना य कारथी शरु करी ॐ कार पर्यंत आठ अक्षरोना मस्तकथी आरंभ  
करी ते ज आठ अंगोमां उलटा क्रमथी न्यास करवा.(4)(5)(6)

**When fear approaches you, after washing your feet and hand,Do internal purification by achamana, wear the holy ring made of Durba,Face the north, sit on a seat of Durba grass and do the hand Symbols,And do holy chants and attain cleanliness of speech.You should then become silent, become engrossed in Narayana,And do suitable actions to tie yourself with the armour of Narayana,And using the eight letters starting with Om, touch the feet,Knees, thighs, belly heart chest, face and head,**

करन्यासं ततः कुर्याद् द्वादशाक्षरविद्यया।प्रणवादियकारन्तमङ्गुल्यङ्गुष्ठपर्वसु।।७

करन्यासं ततः कुर्याद् द्वादशाक्षरविद्यया। प्रणवादियकारन्तमंगुल्यंगुष्ठपर्वसु॥७॥

पछी ॐ नमो भगवते वासुदेवाय अे द्वादशाक्षर मंत्रना ॐ कारथी संपुट करेला अेक  
अेक अक्षरनो आंगणीओमां अने अंगुठानी अणीओमां न्यास करवो. जमण  
डायनी तर्जनी थी मांडी डाला डायनी तर्जनी सुधीनी आठ आंगणीओमां आठ  
अक्षरोनो अने बे अंगुठाना उपरना तथा नीयेना यार सांघाओमां बाकी रडेला यार  
अक्षरोनो न्यास करवो.(7)

Then after touching the eight parts of the body, The feet, Knees, thighs, belly heart chest, face and head, Chanting the eight letter Manthra “Om Namō Narayanaya” Either in an ascending or descending order, You have to perform the knowledge of the twelve letters,

न्यसेद् हृदय ओङ्कारं विकारमनु मूर्धनि। षकारं तु भ्रुवोर्मध्ये णकारं शिखया  
दिशेत् ॥ ८

वेकारं नेत्रयोर्युज्यान्नकारं सर्वसन्धिषु। मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद् बुधः ॥ ९  
सविसर्गं फडन्तं तत् सर्वदिक्षु विनिर्दिशेत्। ॐ विष्णवे नम इति ॥ १०

न्यसेद् हृदय ओङ्कारं विकारमनु मूर्धनि। षकारं तु भ्रुवोर्मध्ये णकारं शिखया दिशेत् ॥  
८

वेकारं नेत्रयोर्युज्यान्नकारं सर्वसन्धिषु। मकारमस्त्रमुद्दिश्य मन्त्रमूर्तिर्भवेद् बुधः ॥ ९ ॥  
सविसर्गं फडन्तं तत् सर्वदिक्षु विनिर्दिशेत्। ॐ विष्णवे नम इति ॥ १० ॥

पછી ” ॐ વિષ્ણવે નમઃ ” એ મંત્રના “ૐ” કારનો હૃદયમાં, “વિ” કારનો મસ્તકમાં, “ષ” કારનો ભ્રુકુટીના મધ્યમાં, “ણ” કારનો શીખામાં , “વે” કારનો બન્ને નેત્રમાં અને “ન” કારનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો, બાકી રહેલા “મ” કારનો ૐ મહ્ અસ્ત્રાય ફટ કરી દિગ્બંધ જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે. (8)(9)(10)

Tell “Sha” and touch the middle of the eye brows, Tell “Na” and touch the top of the hair on your head Tell “Ve” and touch both your eyes, Tell “Na” and touch all your joints, Facing all directions and say “Ma Asthaya Phat”, This would make even the dim witted in to a wise one, And thus you tie all the six directions as directed, And chant “Om salutations to Lord Vishnu”

आत्मानं परमं ध्यायेद् ध्येयं षट्शक्तिभिर्युतम्। विद्यातेजस्तपोमूर्तिमिमं  
मन्त्रमुदाहरेत् ॥ ११

आत्मानं परमं ध्यायेद् ध्येयं षट्शक्तिभिर्युतम्। विद्यातेजस्तपोमूर्तिमिमं  
मन्त्रमुदाहरेत् ॥ ११ ॥

ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય , ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઇષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રુપ જ સમજે. પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાથ કરવો. (11)

**Afterwards meditate on Athma supported by the six strengths,Of Wealth, charity, fame, goddess of wealth, wisdom and renunciation,And chant the following which has the form of knowledge, power and meditation.**

ॐ हरिर्विदध्यान्मम सर्वरक्षां न्यस्ताङ्घ्रिपद्मः पतगेन्द्रपृष्ठे।  
दरारिचर्मासिगदेषुचापाशान् दधानोऽष्टगुणोऽष्टबाहुः ॥१२

ओं हरिर्विदध्यान्मम सर्वरक्षां न्यस्ताङ्घ्रिपद्मः पतगेंद्रपृष्ठे।  
दरारिचर्मासिगदेषुचापाशान् दधानोऽष्टगुणोऽष्टबाहुः ॥12॥

જલેષુ માં રક્ષતુ મત્સ્યમૂર્તિયાદિગણેભ્યો વરૂણસ્ય પાશાત્। સ્થલેષુ  
માયાવટુવામનોસ્વ્યાત્ ત્રિવિક્રમઃ ખેડવતુ વિશ્વરૂપઃ ॥13॥

ॐ गरुडञ्चनी पीठ उपर चरण धरीने रडेला, अणिमादि आठ सिद्धिओथी सेवीत,  
आठ बाहु वाणा शंभ-यक्र-ढाल-तलवार-गदा-बाण-धनुष अने पाशने धारण  
करता हरि भगवान मारी सर्व प्रकारनी रक्षा करण्ठो。(12)

**May all the protection to me be given by Hari,Who keeps his lotus feet on the back of the bird,Who is armed with conch, wheel, sword, mace,Bow and a rope and who has eight qualities and eight hands.**

दुर्गोष्वटव्याजिमुखादिषु प्रभुः पायान्नृसिंहोऽसुरयुथपारिः।विमुञ्चतो यस्य  
महाट्टहासं दिशो विनेदुर्न्यपतंश्च गर्भाः ॥१४

दुर्गोष्वटव्याजिभुजादिषु प्रभुः पायान्नृसिंहोऽसुरयुथपारिः। विमुञ्चतो यस्य  
महाट्टहासं दिशो विनेदुर्न्यपतंश्च गर्भाः ॥14॥

કિલ્લા, વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોનાં સેના પતિઓના  
શત્રુ નૃસિંહ ભગવાન રક્ષા કરજ્ઞો. એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ હસ્યાં  
હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતાં.  
(14)

**In forts, forests, dangerous places and in war,Let me be protected by Lord Narasimha,Who by his mighty roar shook all directions,Broke open the army formation of Asura,And caused pregnant asura Women to abort.**

रक्षत्वसौ माध्वनि यज्ञकल्पः स्वदंष्ट्रयोन्नीतधरो वराहः। रामोऽद्रिकूटेष्वथ विप्रवासे  
सलक्ष्मणोऽव्याद् भरताग्रजोऽस्मान् ॥१५

रक्षत्वसौ माध्वनि यज्ञकल्पः स्वदंष्ट्रयोन्नीतधरो वराहः। रामोऽद्रिकूटेष्वथ विप्रवासे  
सलक्ष्मणोऽव्याद् भरताग्रजोऽस्मान् ॥15॥

पोतानी दाढ वडे पृथ्वीने धारण करनार अने यज्ञोत्पी अव्यव वाणा वराह भगवान  
मार्गमां रक्षा करणो. पर्वतोना शिखरो उपर परशुराम अने प्रवासमां भरतना मोटा  
भाई रामयंद्रण लक्ष्मण सखित मारी रक्षा करणो.(15)

**Let me be protected on my way by Lord Varaha,Who is Yagna personified and who by his protruding teeth,Lifted and carried the earth to safety,Let me be protected on mountain top by Lord ParasuramaLet me be protected when I am abroad By Lord Rama,Who is elder brother of Bharatha and Lakshmana.**

मामुग्रधर्मादखिलात् प्रमादान्नारायणः पातु नरश्च हासात्। दत्तस्त्वयोगादथ योगनाथः  
पायाद् गुणेशः कपिलः कर्मबन्धात् ॥१६

मामुग्रधर्मादखिलात् प्रमादान्नारायणः पातु नरश्च हासात्। दत्तस्त्वयोगादथ  
योगनाथः पायाद् गुणेशः कपिलः कर्मबन्धात् ॥16॥

मारण-मोहन आदि भयंकर अभियारो अने गङ्गलतमांथी नारायण रक्षा करणो.  
गर्वथी नर भगवान, योग ब्रंशथी योगेश्वर दत्तात्रेय अने गुणोना स्वामी  
कपिलदेवण कर्मना बंधनथी रक्षा करणो.(16)

**Let me be protected by Lord Narayana,When I am transgressing Dharma or committing mistakes,Let me be protected from my pride by Sage Nara,Let me protected by Sage Dathathreya,For not engaging in Yoga, meditation and other activitiesAnd let sage Kapila protect me from the bondage of Karma.**

सनत्कुमारो वतु कामदेवाद्धयशीर्षा मां पथि देवहेलनात्। देवर्षिवर्यः  
पुरुषार्चनान्तरात् कूर्मो हरिर्मां निरयादशेषात् ॥१७

सनत्कुमारो वतु कामदेवाद्धयशीर्षा मां पथि देवहेलनात्। देवर्षिवर्यः पुरुषार्चनांतरात्  
कूर्मो हरिर्मां निरयादशेषात् ॥17॥

ભગવાન સનતકુમારો કામદેવથી રક્ષા કરજો અને માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધથી હયગ્રીવ ભગવાન રક્ષા કરજો. નારદજી સેવામાં થતા અપરાધોથી રક્ષા કરજો. સર્વ પ્રકારના નરકથી કચ્છપાવતાર ભગવાન મારી રક્ષા કરજો.(17)

**Let sage Sanath Kumara protect me from the cupid, Let Lord Hayagreeva protect me while I am on travel, As well as when I do action that insults the Devas, Let Sage Narada protect me from sins of non worship of devas, And let Hari who took the form of a tortoise, Protect me from different types of hell.**

ધન્વન્તરિર્ભગવાન્ પાત્વપથ્યાદ્ દ્વન્દ્વાદ્ ભયાદૃષભો નિર્જિતાત્મા । યજ્ઞશ્ચ  
લોકાદવતાજ્જનાન્તાદ્ બલો ગણાત્ ક્રોધવશાદહીન્દ્રઃ ॥૧૮

કૂપથ્યમાંથી ધન્વન્તરિ રક્ષા કરજો. જિતેન્દ્રિય રૂષભદેવજી સુખ દુઃખ શીત ઉષ્ણ આદિ ભયંકર દ્વંદ્વોથી રક્ષા કરજો. લોકપવાદથી યજ્ઞાવતાર રક્ષા કરજો. મનુષ્યકૃત વિદ્વેષથી બળભદ્રજી રક્ષા કરજો. ક્રોધવશ નામના સર્પોના ગણથી શેષનાગ રક્ષા કરજો.(18)

ધન્વન્તરિર્ભગવાન્ પાત્વપથ્યાદ્ દ્વન્દ્વાદ્ ભયાદૃષભો નિર્જિતાત્મા । યજ્ઞશ્ચ  
લોકાદવતાજ્જનાન્તાદ્ બલો ગણાત્ ક્રોધવશાદહીન્દ્રઃ ॥૧૮

**Let Lord Dhanwanthari protect me from unsuitable food, Let Rishabha, the renounced soul protect me. From fear of the contradictory dualities, Let Sage Yajna protect me from gossip of society, Let Lord Balarama protect me from problems created by men, And let Adhi sesha protect me from my anger.**

દ્વૈપાયનો ભગવાન પ્રબોધાદ્ બુદ્ધસ્તુ પાખંડગણાત્ પ્રમાદાત્ । કલ્કિઃ કલે  
કાલમલાત્ પ્રપાતુ ધર્માવનાયોરૂકૃતાવતારઃ ॥૧૯

દ્વૈપાયનો ભગવાન પ્રબોધાદ્ બુદ્ધસ્તુ પાખંડગણાત્ પ્રમાદાત્ । કલ્કિઃ કલે કાલમલાત્  
પ્રપાતુ ધર્માવનાયોરૂકૃતાવતારઃ ॥૧૯

અજ્ઞાનથી વેદવ્યાસ ભગવાન, પાંખડીઓથી અને પ્રમાદથી બુદ્ધાવતાર અને ધર્મ રક્ષાને માટે મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કિ પાપબહુલ કાલિકાલના દોષોથી મારી રક્ષા કરજો.(19)

**Let Sage Vyasa protect me from lack of awakening, Let sage Budha protect me from hypocrisy and ignorance, Let Lord Kalki, who would be born to salvage Dharma, Protect me from the evil effects and thoughts of Kali age.**

मां केशवो गदया प्रातरव्याद् गोविन्द आसङ्गवमात्तवेणुः। नारायण प्राह्ण  
उदात्तशक्तिर्मध्यन्दिने विष्णुररीन्द्रपाणिः ॥२०

मां केशवो गदया प्रातरव्याद् गोविन्द आसंगवमात्तवेणुः। नारायण प्राह्ण  
उदात्तशक्तिर्मध्यन्दिने विष्णुररीन्द्रपाणिः ॥२०॥

सवारमां गदाथी भगवान केशव, वेणुधारी गोविंद भगवान थोडो दिवस थडी आवे  
त्यारे, बरछी-धारी नारायण पूर्वाह्न काळमां अने भगवान विष्णु यकराज सुदर्शन  
लाई मध्याह्न काळमां रक्षा करजो.(20)

May I be protected in the morn by Kesava with his  
mace, May I be protected two hours later By Govinda by  
his flute, Two more hours later let Lord Narayana protect  
by his strength, And at noon let Lord Vishnu protect me his  
holy wheel.

देवोऽपराह्णे मधुहोग्रधन्वा सायं त्रिधामावतु माधवो माम्। दोषे हृषीकेश उतार्धरात्रे  
निशीथ एकोऽवतु पद्मनाभः ॥२१

देवोऽपराह्णे मधुहोग्रधन्वा सायं त्रिधामावतु माधवो माम्। दोषे हृषीकेश उतार्धरात्रे  
निशीथ अकोऽवतु पद्मनाभः ॥२१॥

उग्र धनुष्य धारी मधुसुदन भगवान त्रीज पडोरे ब्रह्मा, विष्णु, रुद्र अे त्रण  
मूर्तिवाला माधव भगवान सायनकाळे, सूर्यास्त पछी हृषीकेश अने मधराते तथा  
मधरात पडेला अेकला पद्मनाभ भगवान रक्षा करजो.(21)

After noon let me protected by Madhu with his great  
bow, In the evening Let Madhwa in the form of trinity  
protect me, Between dawn and midnight let Lord Hrishi  
kesa protect me, And at midnight let Lord Padmanabha  
alone protect me.

श्रीवत्सधामापररात्र ईशः प्रत्यूष ईशोऽसिधरो जनार्दनः। दामोदरोऽव्यादनुसन्ध्यं  
प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः ॥२२

श्रीवत्सधामापररात्र ईशः प्रत्यूष ईशोऽसिधरो जनार्दनः। दामोदरोऽव्यादनुसन्ध्यं  
प्रभाते विश्वेश्वरो भगवान् कालमूर्तिः ॥२२॥

श्री वत्सलांछन श्री हरि भगवान पाछली राते, षडधारी जनार्दन भगवान उषाकाल  
वपते, दामोदर भगवान सूर्योदय पडेलां अने काळमूर्ति विश्वेश्वर भगवान बधी  
संध्याओ वपते रक्षा करजो.(22)

Let me protected by remaining part of the night,By the Lord in whom Srivathsa lives,Let me be protected just before dawn,By Lord Janardhana who holds the sword,Let me be protected at sun rise,By Lord Damodara and just before morn,Let Lord Visweshwara give me protection.

चक्रं युगान्तानलतिग्मनेमि भ्रमत् समन्ताद् भगवत्प्रयुक्तम्।दन्दग्धि  
दन्दग्धिरिसैन्यमासु कक्षं यथा वातसखो हुताशः ॥२३

यकं युगांतानलतिग्मनेमि ભ્રમત્ સમંતાદ્ ભગવત્પ્રયુક્તમ્। દંદગ્ધિ  
દંદગ્ધરિસૈન્યમાસુ કક્ષં યથા વાતસખો હુતાશઃ ॥23॥

સુદર્શન આપનો આકાર ચક્ર જેવો છે. આપની કિનારીનો ભાગ પ્રલયકાળના અગ્નિ જેવો અત્યંત તીવ્ર છે. આપ ભગવાનની પ્રેરણાથી ચોતરફ ધૂમ્પા કરો છો. જેવી રીતે આગ વાયુની સહાયથી સૂકા ઘાસ કુસને બાળી નાખે છે તેવી રીતે આપ અમારી શત્રુ સેનાને ઘડઘડાટ બાળી નાખો, બાળી નાખો.(23)

Oh holy Wheel,your edges are like the raging fire of deluge,You are sent by the God and rotate and travel everywhere,And so like the fire with the help of wind,Burns in to ashes the dried up wood of a forest,Speedily and speedily burn and burn all my enemies.

गदेऽशनिस्पर्शनविस्फुलिङ्गे निष्पिण्ठि निष्पिण्ठ्यजितप्रियासि।  
कूष्माण्डवैनायकयक्षरक्षोभूतग्रहांश्रूर्णय चूर्णयारीन् ॥२४

ગદેઽશનિસ્પર્શનવિસ્ફુલિંગે નિષ્પિંઠિ નિષ્પિંઠ્યજિતપ્રિયાસિ।  
કૂષ્માંડવૈનાયકયક્ષરક્ષોભૂતગ્રહાંશ્રૂર્ણય ચૂર્ણયારીન્ ॥24॥

કૌમોદકી ગદા, આપમાંથી છુટતી ચીંગારીનો સ્પર્શ વજ્ર જેવો અસહ્ય છે, ભગવાન અજિતની પ્રિયા છો, હું એમનો દાસ છું. તેથી આપ કુશમાંડ, વિનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત અને પ્રેતાદી ગ્રહોને સડસડાટ કચરી નાખો, કચરી નાખો તથા મારા શત્રુઓને ચૂર્ણ કરી નાખો.(24)

Oh mace, the spark raising touches of yours,Are unbearable like the touch of Vajra,And you are dear to the invincible lord and his servant,And so please powder and powder again,Evil spirits, Yakshas, Rakshasas and all my enemies.



त्वं यातुधानप्रमथप्रेतमातृपिशाचविप्रग्रहघोरदृष्टीन्।दरेन्द्र विद्रावय कृष्णपूरितो  
भीमस्वनोऽरेर्हृदयानि कम्पयन् ॥२५

त्वं यातुधानप्रमथप्रेतमातृपिशाचविप्रग्रहघोरदृष्टीन्। दरेन्द्र विद्रावय कृष्णपूरितो  
भीमस्वनोऽरेर्हृदयानि कम्पयन् ॥25॥

શંખ શ્રોષ્ઠ, આપ ભગવાન શ્રી કૃષ્ણની કૂંકથી ભયંકર અવાજ કરી મારા શત્રુઓનાં  
દિલ ધ્રુજાવી ડો અને યાતું ધન પ્રમથ, પ્રેમ, માતૃકા, પિશાચ તથા બ્રહ્મારાક્ષસ વગેરે  
ભયાનક પ્રાણીઓને અહીંથી ઝટપટ ભગાડી મુકો.(25)

**Oh Conch, when Lord Krishna blows in you,You create a  
huge and loud Sound and confuse my enemies,And drive  
away ghouls, devils, ghosts, Pramadhhas,Brahma Rakshas  
and other fearful beings.**

**divider**

ત્વં તિગ્મધારાસિવરારિસૈન્યમીશપ્રયુક્તો મમ છિન્ધિ છિન્ધિ।ચર્મજ્જતચન્દ્ર છાદય  
દ્વિષામઘોનાં હર પાપચક્ષુષામ્ ૨૬

ત્વં તિગ્મધારાસિવરારિસૈન્યમીશપ્રયુક્તો મમ છિન્ધિ છિન્ધિ। ચર્મજ્જતચન્દ્ર છાદય  
દ્વિષામઘોનાં હર પાપચક્ષુષામ્ ॥26॥

ભગવાનની પ્રિય તલવાર, આપની ધાર અત્યંત તીક્ષ્ણ છે. આપ ભગવાનની  
પ્રેરણાથી મારા શત્રુઓને છિન્ન ભિન્ન કરી દો. ભગવાનની વહાલી ઢાલ, આપમાં  
સેંકડો ચંદ્રાકાર મંડળ છે. આપ પાપ દ્રષ્ટિવાળા પાપઆત્મા શત્રુઓની આંખ બન્ધ  
કરી દો અને એમને સદાને માટે અંધ બનાવી દો.(26)

**Oh holy sword, Be sent by the Lord himself,And cut and  
cut my enemy army in to pieces,Oh shield of the  
lord,shining like hundred moons,Please make my enemies  
with full of sins look blind.**

યન્નો ભયં ગ્રહેભ્યો ભૂત્ કેતુભ્યો નૃભ્ય એવ ચ।સરીસૃપેભ્યો દંષ્ટ્રિભ્યો ભૂતેભ્યોઽહોભ્ય  
એવ વા ॥૨૭

સર્વાણ્યેતાનિ ભગન્નામરૂપાસ્ત્રકીર્તનાત્।પ્રયાન્તુ સંક્ષયં સઘો યે નઃ શ્રેયઃ પ્રતીપકાઃ  
॥૨૮

યન્નો ભયં ગ્રહેભ્યો ભૂત્ કેતુભ્યો નૃભ્ય એવ ચ। સરીસૃપેભ્યો દંષ્ટ્રિભ્યો  
ભૂતેભ્યોઽહોભ્ય એવ વા ॥27॥

સર્વાણ્યેતાનિ ભગન્નામરૂપાસ્ત્રકીર્તનાત્। પ્રયાન્તુ સંક્ષયં સઘો યે નઃ શ્રેયઃ પ્રતીપકાઃ ॥  
28॥

यथा हि भगवानेव वस्तुतः सद्सत्यं यत्। सत्यनानेन नः सर्वे यांतु नाशमुपाद्रवाः ॥  
31॥

સઘળું જગત ખરી રીતે ભગવાનનું જ સ્વરૂપ છે. સત્યથી અમારા સઘળા ઉપદ્રવ  
નાશ પામો. (31)

**The truth that God is all beings and things, May destroy all  
the troubles that we face.**

यथैकात्म्यानुभावानां विकल्परहितः स्वयम्। भूषणायुद्धलिङ्गाख्या धत्ते शक्तिः  
स्वमायया ॥३२

યથૈકાત્મ્યાનુભાવાનાં વિકલ્પરહિતઃ સ્વયમ્। ભૂષણાયુદ્ધલિંગાખ્યા ધત્તે શક્તિઃ  
સ્વમાયયા ॥32॥

અભેદ દૃષ્ટિવાળાઓને ભગવાન ભેદ રહિત છે તો પણ એ પોતાની માયાથી ભૂષણ,  
આયુધ અને રૂપ નામની શક્તિઓથી ધારણ કરે છે એ વાત નિશ્ચિત રૂપથી ખરી છે.  
(32)

**Those great savants who think, that God does not have  
any forms, And his weapons and ornaments are only  
Symbols without power,**

**divider**

तेनैव सत्यमानेन सर्वज्ञो भगवान् हरिः। पातु सर्वैः स्वरूपैर्नः सदा सर्वत्र सर्वगः ॥३३

તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન્ હરિઃ। પાતુ સર્વૈઃ સ્વરૂપૈર્નઃ સદા સર્વત્ર સર્વગઃ ॥  
33

તો એ સત્ય અનુસાર સર્વજ્ઞ સર્વ વ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ સ્વરૂપો વડે સર્વ  
કાળમાં અને સર્વ દેશમાં અમારી રક્ષા કરો. (33)

**And due to this truth, the God Hari is everywhere, And let  
him protect me always and everywhere.**

विदिक्षु दिक्षूर्ध्वमधः समन्तादन्तर्बहिर्भगवान् नारसिंहः। प्रहापयँल्लोकभयं स्वनेन  
ग्रस्तसमस्ततेजाः ॥३४

વિદિક્ષુ દિક્ષૂર્ધ્વમધઃ સમંતાદંતર્બહિર્ભગવાન્ નારસિંહઃ। પ્રહાપય~ લ્લોકભયં સ્વનેન  
ગ્રસ્તસમસ્તતેજાઃ ॥34॥

જેના નામની ગર્જનાથી નૃસિંહ ભગવાન લોકોના ભયને મટાડે છે અને જેના પ્રભાવથી પ્રહલાદજી ઝેર વગેરે સર્વના સામર્થ્યને ગળી જાય છે. તેવા તે દિશાઓમાં, ખૂણાઓમાં, ઊંચે, નીચે, અંદર, બહાર અને ચારે બાજુએ અમારી રક્ષા કરો.(34)

**Let the Lord Narasimha who due to his power, Destroyed elephants, serpents and other beings And saved Prahladha, and removed the fear of the world,, Protect me in all directions and non directions, Top and below, inside and outside and in all places.**

મઘવન્નિદમાખ્યાતં વર્મ નારયણાત્મકમ્ | વિજેષ્યસ્યઞ્જસા યેન દંશિતોઽસુરયૂથપાન્  
||૩૫

મઘવન્નિદમાખ્યાતં વર્મ નારયણાત્મકમ્ | વિજેષ્યસ્યઞ્જસા યેન દંશિતોઽસુરયૂથપાન્  
||35||

વિશ્વરૂપે કહ્યું : હે ઇન્દ્ર ! મેં તને આ ' નારાયણ કવચ ' કહ્યું તે પાઠ કરી લે. પછી તું મોટા મોટા દૈત્યને વગર પરિશ્રમે જીતી શકીશ.(35)

**Oh Indra, thus I have told you, the great armour of Narayana, And using this you protect yourselves and easily, Defeat the commanders of the army of Rakshasas.**

एतद् धारयमाणस्तु यं यं पश्यति चक्षुषा | पदा वा संस्पृशेत् सद्यः साध्वसात् स  
विमुच्यते ||३६

એતદ્ ધારયમાણસ્તુ યં યં પશ્યતિ ચક્ષુષા | પદા વા સંસ્પૃશેત્ સદ્યઃ સાધ્વસાત્ સ  
વિમુચ્યતે ||36||

આ કવચને ધારણ કરનાર પુરુષ જેની પણ સામું જુએ કે જેનો પગથી સ્પર્શ કરે, તે પણ સમસ્ત ભયથી મુક્ત થઈ જાય છે.(36)

**If he who wears his armour sees any one by his eyes, Or even touches him by his feet, that man, Would be able to get rid of all his fears.**

न कुतश्चित् भयं तस्य विद्यां धारयतो भवेत् | राजदस्युग्रहादिभ्यो व्याघ्रादिभ्यश्च  
कर्हिचित् ||३७

ન કુતશ્ચિત ભયં તસ્ય વિદ્યાં ધારયતો ભવેત્ | રાજદસ્યુગ્રહાદિભ્યો વ્યાઘ્રાદિભ્યશ્ચ  
કર્હિચિત્ ||37||

આ વૈષ્ણવી વિદ્યા ધારણ કરનારા પુરુષને રાજા, ચોર, ગ્રહ કે વાઘ આદિ હિંસક પશુઓથી કદી ભય થતો નથી.(37)

**He who wears this armour will never have any fear,From king, enemies, planets and animals like the tiger.**

इमां विद्यां पुरा कश्चित् कौशिको धारयन् द्विजः।योगधारणया स्वाङ्गं जहौ स मरूधन्वनि ॥३८

ઇમાં વિદ્યાં પુરા કશ્ચિત્ કૌશિકો ધારયન્ દ્વિજઃ। યોગધારણયા સ્વાંગં જહૌ સ મરૂધન્વનિ ॥38॥

પ્રાચીન કાળમાં આ વિદ્યાને ધારણ કરનાર કોઈ કૌશિક ગૌત્રના બ્રાહ્મણે આ વિદ્યા ધારણ કરી યોગ ધારણાંથી નિર્જન દેશમાં પોતાનો દેહ છોડેલો.(38)

**Long time ago, this knowledge was worn by a Brahmin,From Koushika Gothra and he gave up his life in a desert.**

तस्योपरि विमानेन गन्धर्वपतिरेकदा।ययौ चित्ररथः स्त्रीर्भिवृतो यत्र द्विजक्षयः ॥३९  
गगनान्यपतत् सद्यः सविमानो ह्यवाक् शिराः।स वालखिल्यवचनादस्थीन्यादाय  
विस्मितः।प्रास्य प्राचीसरस्वत्यां स्नात्वा धाम स्वमन्वगात् ॥४०

તસ્યોપરિ વિમાનેન ગંધર્વપતિરેકદા। યયૌ ચિત્રરથઃ સ્ત્રીર્ભિવૃતો યત્ર દ્વિજક્ષયઃ ॥  
39॥

ગગનાન્યપતત્ સદ્યઃ સવિમાનો હ્યવાક્ શિરાઃ। સ વાલખિલ્યવચનાદસ્થીન્યાદાય  
વિસ્મિતઃ।

પ્રાસ્ય પ્રાચીસરસ્વત્યાં સ્નાત્વા ધામ સ્વમન્વગાત્ ॥40॥

એક દિવસ પોતાની સ્ત્રીઓ સાથે ગંધર્વોનો અધિપતિ ચિત્રરથ વિમાનમાં બેસીને આકાશમાં જતો હતો. તે જ્યાં બ્રાહ્મણનો દેહ પડ્યો હતો ત્યાં ઉપર આવતા તુરંત વિમાન સહિત ઊંધે માથે પૃથ્વી ઉપર પડ્યો. આ ઘટનાથી એના આશ્ચર્યની સીમા ન રહી, જ્યારે વાલખીલ્ય મુનિઓએ એને સમજાવ્યું કે આ ' નારાયણ કવચ ' ધારણ કરવાનો પ્રભાવ છે.ત્યારે ચિત્રરથ આ બ્રાહ્મણના અસ્થિને ઉપાડી પ્રાચી-સરસ્વતીમાં વહાવી દીધા અને પછી એ સ્નાન

**A gandharwa called Chithra radha was travelling in a plane.Along with his ladies, where the Brahmins body was lying.At that spot his plane stopped and he fell there along with his ladies,And he was perplexed and was advised by the sages called Balakhilya,And obeying their advice, took the bones of the Brahmin,And put it in the river Saraswathi, took bath and went back to his home.કરી**

પોતાના લોકમાં ગયો.(39)(40)

**eAstroHelp**

॥श्रीशुक उवाच॥

य इदं शृणुयात् काले यो धारयति चादृतः। तं नमस्यन्ति भूतानि मुच्यते सर्वतो भयात्  
॥४१

ય ઇદં શૃણુયાત્ કાલે યો ધારયતિ ચાદૃતઃ। તં નમસ્યંતિ ભૂતાનિ મુચ્યતે સર્વતો  
ભયાત્ ॥41॥

શ્રી શુકદેવજીએ કહ્યું : જે માણસ આ ' નારાયણ કવચ ' ને યોગ્ય સમયમાં આદર  
સહિત સાંભળે ક ધારણ કરે તેની સામે બધા પ્રાણીઓ આદરથી નમી પડે છે અને તે  
બધી જાતનાં ભયથી મુક્ત થઈ જાય છે.(41)

**He who wears or hears this armour of Narayana, Would be saluted by all beings and he would get rid of all fears.**

एतां विद्यामधिगतो विश्वरूपाच्छतक्रतुः। त्रैलोक्यलक्ष्मीं बुभुजे  
विनिर्जित्यऽमृधेसुरान् ॥४२

એતાં વિદ્યામધિગતો વિશ્વરૂપાચ્છતક્રતુઃ। ત્રૈલોક્યલક્ષ્મીં બુભુજે  
વિનિર્જિત્યઽમૃધેસુરાન્ ॥42॥

હે પરીક્ષિત વિશ્વરૂપ પાસેથી આ વિદ્યા પ્રાપ્ત કરી ઇન્દ્રદેવે દૈત્યોને જીતી, ત્રેઈલોક્યનું  
રાજ્ય ભોગવ્યું.(42)

**Learning this knowledge from Viswaroopa, Indra, Won in the battle over all asuras and, Got the blessings of wealth of the three worlds,**

॥इति श्रीनारायणकवचं सम्पूर्णम्॥ ( श्रीमद्भागवत स्कन्ध 6 , अ। 8 )

॥ઇતિ શ્રીનારાયણકવચં સંપૂર્ણમ્॥ ( શ્રીમદ્ભાગવત સ્કંધ 6, અ। 8 )

॥ ઇતિ શ્રી ભાગવતે મહાપુરાણે ષષ્ટ સ્કંધે 'નારાયણ કવચ' નામો અષ્ટમો અધ્યાય  
સંપૂર્ણ ॥